



જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૧/૧૦/૨૦૧૮ ગુરૂવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૯૮૩/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૭ કેસ કરી, ૨૪ વ્યક્તિઓને ઝડપી, ૫૧ લીટર દેશી દારૂ, ૧૨૬ બોટલ ઇંગ્લીશ દારૂ અને ૧ સ્ફટક કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૨ કેસ કરી ૨ વ્યક્તિઓની અટક કરી રોકડ રૂપિયા ૨૪૪૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૯૮૪/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૩૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧૯ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૧૯૮૫/૧૮

ગોમતીપુર: સરોજદેવ વા/ઓ કૃષ્ણપાલસિંહ રાજપુત (રહે.કાશીબાઇની ચાલી બળીયાકાકા ચાર રસ્તા રખિયાલ રોડ ગોમતીપુર) એ ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૯/૧૦/૧૮ રાતના ૯/૩૦ થી તા.૧૦/૧૦/૧૮ સાજના ૪/૩૦ વાગ્યા દરમિયાન પોતાના મકાનની લોખંડની જાળીનો નકુચો તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૯૩,૮૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી બી.કે.ભુનાતર ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૧૯૮૬/૧૮

નવરંગપુરા: રેખાબહેન વા/ઓ પીન્કેશ નાહર (ઉ.વ.૩૭)(રહે.અનમોલ ટાવર એસ.વી.રોડ ગોરેગાંવ વેસ્ટ મુંબઈ) તા.૧૦/૧૦/૧૮ સાજના ૬/૧૫ વાગ્યાના સુમારે નવરંગપુરા લો ગાર્ડન ખાતે ચણીયા ચોળી બજારમાં ખરીદી કરવા ગયા હતા ત્યારે રેખાબહેનની નજર ચુકવી તેમના પર્સમાંથી અજાણી વ્યક્તિએ આશરે રોકડ રૂપિયા ૮૦,૦૦૦/- અને અગત્યના દસ્તાવેજોની ચોરી કરી લીધી હતી. આ અંગેની ફરીયાદ રેખાબહેન નાહરે નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.ટી.ચૌધરી ચલાવે છે.

કારંજ: પિયુષભાઈ ચંદુલાલ (રહે.શ્યામલ રો-હાઉસ શ્યામલ ચાર રસ્તા પાસે સેટેલાઈટ) એ કારંજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૦/૧૦/૧૮ કલાક ૮/૦૦ થી ૮/૩૦ વાગ્યા દરમ્યાન કારંજ ભદ્રકાળી મંદીરમાં પિયુષભાઈની નજર ચુકવી અજાણી વ્યક્તિએ પિયુષભાઈનો એપલ કંપનીનો આઈફોન-૧૦ મોડલનો મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- ચોરી કરી લીધો હતો. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.આઇ.મકરાણી ચલાવે છે.

વાહન અકસ્માતમાં મૃત્યુ :-

સમાચાર યાદી નં.૧૯૮૭/૧૮

નારોલ: રાજેશકુમાર રમણભાઈ સોલંકી (રહે.શકિત રો-હાઉસ જોગણી માતાના મંદિર પાસે શાહવાડી નારોલ) એ નારોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૯/૧૦/૧૮ બપોરના ૩/૪૫ વાગ્યાના સુમારે નારોલ સર્કલ પાસે ગોકુલેશ પેટ્રોલપંપ સામેથી રાજેશકુમારના પિતા રમણભાઈ ચાલતા પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા મોટર સાયકલના ચાલકે મોટર સાયકલ પુરઝડપે અને બેદરકારીથી ચલાવી રમણભાઈને ટક્કર મારતા ગંભીર ઈજાઓ થતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.બી.રાહોડ ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૧૯૮૮/૧૮

સાબરમતી: મંગેશભાઈ ઇગનભાઈ સોલંકી (ઉ.વ.૪૫) (રહે. જગન્નાથ ઇન્દીરાનગર સી.ટી.ગોલ્ડ સીનેમા સામે સાબરમતી) એ અગમ્ય કારણસર તા.૧૦/૧૦/૧૮ નારોજ પોતાના ઘરે લોખંડની ઓંગલ સાથે દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે સાબરમતી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી સુરેશભાઈ બાબુભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.